

## જુંદગી, જુંદગી : શોખથી જીવતું, શાનથી મરવું

--ચંદ્રકંત બક્સી

લંડનના 'ટાઈમ્સ'માં જુન ૨, ૨૦૦૩ના અંકમાં એક વીજાપન હતું. એ લોકો માટે, જેઓ આંખની રોશની ખોવાના હતા, જેમની આવતી કાલ અંધકારમાં તુંબી જવાની હતી. પણ આજ તમારા અંકુશમાં છે, અને આજે જીવી શકાય છે. શું શું કરી શકાય છે? આજે : લોંગ ડ્રાઇવ પર જાઓ. બાળકોને વાતર્ચ વાંચી સંભળાવો. ઇન્ટરનેટને સહી કરો. બારમાં જઈને બારમેઈડને જોયા કરો. પતંગ ઉડાવો. સ્ટોરમાં જઈને ભાવતાલ કરો. તુમ સજાવો. ટોળામાં ખોવાઈ જાઓ. સુપરમાર્કેટ ફરો. ઇલેક્ટ્રોનિકો બલ્બ બદલો. પ્રદર્શનમાં જાઓ. રસ્તો કોસ કરીને પાછા આવો. સાઈકલ ચલાવો. લોટરીની ટીકીટ ખરીદો. ટીવી જુઓ. ચા બનાવો. બગીચામાં ફરી આવો. તાશ રમો. વાળને જુદ્દી રીતે ઓળો. એક લખો, અને ફાડી નાખો. લોકલ ટ્રેનમાં આંટો મારી આવો. સીધા સુઈને એક પુસ્તક વાંચો. તુમમાં વસ્તુઓ સાફ કરો. એમની જગ્યાઓ બદલો. કોઈ પણ અનજાણ રત્નીને ફોન કરો. ચહેરા પર હલકો મેક-અપ લગાવો. કોઈને કહો કે એ સરસ લાગે છે. હસો. આવતી કાલે કદાચ આંખોની રોશની ચાલી જશો! આ પુરી સુચી અંગેજ જીવનની છે; પણ આમાં ભારતીય પરંપરા પ્રમાણે ફેરફાર કરી શકાય છે. પાન ખાઓ. ઠાશ પીઓ. ખરખરે જઈ આવો. સવારે મંદીરમાં જઈને આરસની ફર્શ પર ખુણામાં બેસીને જે વીધીઓ થાય છે તે જુઓ, સાંભળો. પત્નીએ બનાવેલા બટાટાના શાકની તારીફ કરો. આ પત્યા પછી ઉઘી જાઓ! ડાબી તરફ પડખું ફરીને. ઘસઘસાટ.

ઘણા માણસો ટપમે વરસે આવનારા મૃત્યુ સુધીનું ખાનીંગ કરતા હોય છે. ઘણાને પટમે નીવૃત્ત થયા પછી શું કરીશું એ ખબર હોતી નથી. રૂપીયા કમાઈ લીધા, હવે એમાંથી બહાદુરી અને કુનેહ અને હીમતનાં તત્ત્વો પસાર થઈ ગયાં છે. હવે જે છોકરાને તમે દુષ્ટે મહીને તકીયાઓ ગોઈવીને બેસતાં શીખવ્યું હતું એ હવામાં ઉડી રહ્યો છે. હવે લોકોના

(૨)

સ્મીતમાંથી તમને ઉપહાસ દેખાયા કરે છે. હવે ટેલીફોન અને ડોરબેલ ઓછા વાગે છે. હવે ગઈકાલનો પશ્ચાત્તાપ અર્થહીન છે, હવે આવતીકાલની ચીંતા અપ્રસ્તુત છે. હવે આજને પણ શોધતા રહેવું પડે છે. અને એક વરસના ઉત્ત્રપ દીવસો છે અને એક દીવસના ર૪ કલાકો છે અને એક વરસના ૮૭૬૦ કલાકો થાય છે. જર્મનીમાં વૈજ્ઞાનીક સંશોધન કરીને નીછ્ખ કાઠવામાં આવ્યો છે કે એક જર્મન માણસ વરસના ૮૭૬૦ કલાકોમાંથી ૨૮૦૦ કલાક સુઈ રહે છે, એટલે જાગૃત અવસ્થાના એની પાસે ૫૮૬૦ કલાકો બાકી રહે છે. વૃદ્ધ અવસ્થાની કરુણતા એ છે કે આ એક કલાક પણ ૧૨૦ મીનીટ જેટલો લાંબો હોય છે. વીસમી સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનીક ડૉક્ટર આલ્બર્ટ આઈનસ્ટાઇનને અંતીમ ઝોપરેશન કરવાનું હતું. એમણે કહ્યું: ‘બનાવટી રીતે જુંદગી લંબાવે રાખવી અર્થહીન છે. મેં મારું કર્મ કરી લીધું છે. હવે વીદાયનો સમય થઈ ગયો છે!’ મૃત્યુ સામાન્ય માણસને હલાવી નાખે છે. જીવતાં આવડવું એક વાત છે. મરતાં આવડવું બીજી વાત છે. ઘણા એવા પણ હોય છે, જેમને શોખથી જીવતાં આવડે છે અને શાનથી મરતાં આવડે છે...

અને ઘણા એવા હોય છે જે જુંદગીના છેલ્લા કલાકો કે દીવસો સુધી ઈશ્વરે આપેલી બધી જ ઈદ્દીયોની ભરપુર મજા લુંટતા હોય છે. ગાર્દીશી-આરમાની ત્રાટકે ત્યારે બડી મહબિની...નાં ગીતો ગાઈ શકનારા ખુશાદીલ લોકો પણ હોય છે. શરીરનાં સેંકડો અંગો અને ઉપાંગો આપણી ઈચ્છા પ્રમાણે સક્રીય થવાનાં નથી, કે મરવાનાં નથી. જમણી આંખની ઉમર ૪૦ વરસની હશે, ડાબી આંખ ૬૦ની થઈ હશે. જમણો કાન ત્રીસ ટકા સાંભળતો હશે, અને ડાબા કાનની શ્રવણશક્તી હજી ૮૦ ટકા રહી હશે. હીંદુ માણસોએ શુભ અને અશુભની જુદીજુદી જવાબદારીઓ જમણા, અને ડાબા હાથને સોંપી દીધી છે. મૃત્યુની મજા એ છે કે ચીતા ઉપર નીશેતન દેહની સાથે સાથે બધાં જ વીશેપણો સળગી જાય છે. અને વીશેપણોની રાખ પડતી નથી, વીશેપણોમાંથી ધૂમાડો ઉદ્ધતો નથી..

(૩)

પ્રશ્ન એક જ છે: છંદગી, તારી નર્મ બાંહોમાં હું કેટલો બુઝાઈ શકું છું? જન્મની ક્ષાળથી મૃત્યુનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ જાય છે! દરેક જીવાતી ક્ષાળ માણસને મૃત્યુ તરફ ધકેલતી રહેતી હોય છે. કાળધર્મ પામ્યા અને દેહલીલા સમાપ્ત કરી અને અવસ્થાન પામ્યા અને નીવર્ણા થયું જેવા શબ્દપ્રયોગો વાંચ્યું છું કે સાંભળું છું ત્યારે કોઈ અરુચીકર વ્યંજન ઉપર આકષીત કરવા માટે ગાન્નિશ કર્યું હોય એવી ફીલીંગ થયા કરે છે.

મૃત્યુ વીશેની મારી માન્યતા જુદી છે. છંદગી ફાની છે, લા-ફાની નથી. બેક્ટેરીયા અને વાયરસ જીવનશાસ્ત્રના શબ્દો નથી, એ જીવશાસ્ત્રના શબ્દો છે, અને મારો એવા શબ્દો સાથેનો સંબંધ અત્યંત સીમીત છે. જીવનને મૃત્યુના સંદર્ભમાં જોવું એ દર્શન છે. મારી ‘સમકાલ’ નામની નવલક્યાના અંત તરફ નાયક રનીલ કથાની નાયીકા આરનાને કહે છે, એ મને જીવન અને મૃત્યુ વીશેના સૌથી પ્રામાણીક વીચારો લાગ્યા છે. આરના! સાથે સુખી થવા કરતાં સાથે દુખી થવામાં વધારે આત્મીયતા છે... બે દુખોનો સરવાળો સુખ બની જાય છે... કેટલાનાં તકદીરમાં સાથે દુખી થનાર મળે છે? સાથે સાથે દુખો જીવવાની ઉષ્મા કેટલાનાં ભાગ્યમાં હોય છે? આરના! ખુશીથી રડી લે! ખુબ ખુશીથી રડી લે! આંસુઓ ભીજવી શકે એવી છાતીઓ મળતી નથી... અને એક દીવસ એકલા રડવું પડે છે, રડી લેવું પડે છે!...

જીવન અને મૃત્યુ વીશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે. પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દીવસ બરફનું બંધન ઓગળશે કે તુટશે. એક દીવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે. એક દીવસ અંદરનું બંધ પાણી બહારનાં વહેતાં પાણીમાં હુબી જશે. કદાચ અને જ મૃત્યુ કહેતા હશે. મુક્તીનું બીજું નામ.

મૃત્યુ આવે ત્યાં સુધી જીવતા રહ્યા કરવું એ ઘણા માટે નીવૃત્તિની વ્યાખ્યા છે. નીવૃત્તિ એટલે, મારી દાઢીએ, કોઈના આદેશ કે હુકમથી હું કામ કરું છું એ અંતીમ ક્ષાળ પસાર થઈ ગયા પછીની પ્રવૃત્તિ, જેમાં હું જ માલીક છું, અને હું જ નોકર છું, હું મનસ્વી રીતે, સ્વેચ્છાથી, મને ગમે એ

(૪)

કામ કરતો રહું. પહેલાં પાંચ કલાક કામ કરીને થાક લાગતો હતો, હવે દસ કલાક કામ કરીને સંતૃપ્તિ મળે છે. નીવૃત્તિ અને પ્રવૃત્તિની વ્યાખ્યાઓ દરેક વ્યક્તિએ પોતે નક્કી કરી લેવાની હોય છે. અને આંકડાઓનું યથાર્થ ધૂજાવે એવું છે. સન ૨૦૧૬ સુધીમાં દર ૧૦૦૦ ભારતીયોમાંથી ૮૮ની ઉમર ૬૦ વર્ષ ઉપરની હશે. અને આજે ભારતની વયસ્ક વ્યક્તિમાંથી માત્ર અગીયાર ટકા લોકોને જ વૃ દ્વારાસ્થા માટે સોશલ સીક્યુરીટી કે સામાજિક સલામતીનું કવર છે. નીવૃત્તિનું આયોજન એક એવો વીપ્ય છે, જે હજુ આપણને સ્પર્શયો નથી!

અને જીવતા માણસને મૃત્યુનો અનુભવ હોતો નથી પણ ‘ઉઘ’ એ મૃત્યુનો ‘ડાય રન’ છે, રીહર્સલ છે. કદાચ માટે જ સંસ્કૃતમાં મૃત્યુ માટે ‘ચીરની દ્વા’ જેવો શબ્દ આવ્યો છે.

### કલોઝ અપ:

ભગત જગત કો ઠગત હૈ, ભગતહીં ઠગે સો સંત;  
જો સંતન કો ઠગત હૈ, તીન કો નામ મહંત.

--ઉત્તર ભારતની લોકોકૃતી

(અર્થ: ભક્તો જગતને ઠગે છે, ભક્તોને ઠગે છે એ સંત છે; જે સંતોને ઠગે છે એને મહંત કહેવાય છે.)

### --ચંદ્રકાંત બક્ષી

તા. ૪ ઓક્ટોબર ૨૦૦૭ના ‘અભીયાન’ના પાન ૧૩ પરથી સાભાર..

--‘કલાપી-ગુર્જરી’ ફેન્ટમાં અને ‘ઉજા જોહરી’માં પુનર્લેખન:

[uttamgajjar@hotmail.com](mailto:uttamgajjar@hotmail.com)